



## ફાર્મ મશીનરી અને પાવર ઈજનેરી વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા

“ડેવલપિંગ અ વોટરશેડ બેઝડ કોન્કલેવ ઓફ એક્સ્પરીમેન્ટલ લર્નિંગ એટ કાંકણપુર” પ્રોજેક્ટ અંતર્ગત  
“કૃષિમાં યાંત્રિકીકરણ થકી આવક વધારવાના ઉપાયો”

વિષય આધારિત તા. ૦૮/૦૩/૨૦૧૯ ના રોજ એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો.

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા ખાતે તા. ૦૮/૦૩/૨૦૧૯ ના રોજ “કૃષિમાં યાંત્રિકીકરણ થકી આવક વધારવાના ઉપાયો” વિષય ઉપર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સૌ પ્રથમ અત્રેની કોલેજના આચાર્ય અને ડિનશ્રી તેમજ વિભાગીય વડાશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરીને “કૃષિમાં યાંત્રિકીકરણ થકી આવક વધારવાના ઉપાયો” આધારિત તાલીમ સંપુટનું ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ ડો.આર.સ્વર્ણકાર,પ્રાધ્યાપક અને વડાશ્રી, ફાર્મ મશીનરી અને પાવર ઈજનેરી વિભાગ દ્વારા કોલેજના આમંત્રિત વિભાગીય વડાઓ, કર્મચારીગણ તથા આત્મામાંથી પધારેલ શ્રી યોગેશભાઈનું તથા ખેડૂતોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં ડો.આર.સ્વર્ણકાર,પ્રાધ્યાપક અને વડાશ્રીએ ખેતીમાં “કૃષિમાં યાંત્રિકીકરણનું મહત્વ અને તેના ફાયદાઓ” વિષે પોતાની આગવી શૈલીમાં ખુબ સુંદર સમજ આપી. ત્યારબાદ અત્રેના BEAS વિભાગના મદદનીશ પ્રાધ્યાપકો શ્રીમતી હેતલ તન્ના તથા શ્રીમતી શેફાલી મોદી દ્વારા અનુક્રમે “કૃષિમાં ખેડૂતની આવક વધારવા માટે ખેડૂત મહિલાની ભૂમિકા” તેમજ “ સોઈલ હેલ્થ કાર્ડનું મહત્વ” વિષય પર સરસ વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ ઈજ.શ્રી કે.એલ.ડાભી, મદદનીશ પ્રાધ્યાપક અને ફાર્મ મેનેજરશ્રી દ્વારા “જુદા જુદા પાકોની વાવણી માટે જમીન તૈયાર કરવા માટેનાં સાધનો તથા કાર્યપદ્ધતિ” અંતર્ગત કૃષિ યાંત્રિકીકરણ માટે વપરાતાં સાધનો વિષે ખુબ સરસ વક્તવ્ય આપવામાં આવ્યું. આ ઉપરાંત સર્વશ્રી ડો.નવનીતકુમાર (સહ પ્રાધ્યાપક અને વિભાગીય વડા, PFE વિભાગ) તથા ઈજ.આર.એસ.ગોધાણી (સી.રી.આસી., ફાર્મ મશીનરી અને પાવર ઈજનેરી વિભાગ) દ્વારા અનુક્રમે “કૃષિપેદાશોનું મુલ્યવર્ધન” તેમજ “આંતરખેડ(નીંદામણ)નું મહત્વ તથા તેના માટે વપરાતાં જુદાં જુદાં સાધનો” વગેરે વિષયો આધારિત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંત ભાગમાં યાંત્રિકીકરણના જુદા જુદા સાધનોનું શ્રી આર.એસ.ગોધાણી તથા શ્રી નીરવ સોલંકી તથા FMP વિભાગના કર્મચારીગણ દ્વારા નિદર્શન ગોઠવવામાં આવ્યું. કાર્યક્રમના અંતમાં ઈજ.શ્રી કે.એલ.ડાભી, મદદનીશ પ્રાધ્યાપક ફાર્મ મશીનરી અને પાવર ઈજનેરી વિભાગ દ્વારા ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

